

## “સહજ સમાધ”

—માધવ ગોર

“દાદા, તમે ગાંગુલીનું નામ જ્યારે જ્યારે બોલો છો ત્યારે ત્યારે લોચો મારો છો!”  
ગામદેથી જ્યારે જ્યારે દીકરીને ઘેર આવું ત્યારે આ અમારી બરખા-દોતરી-મારી ખબર  
લઈ નાંજે છો!

“શેમાં લોચો? બોલ! સુધરવા તૈયાર!” મેં કહ્યું.

“તમે ‘સૌરભ’ બોલો છો! લખો છોય ‘સૌરભ’.”

“તે?”

“બધાં જ - અંગેજી-ગુજરાતી છાપાં-પુસ્તકો બધે બધા ‘વ’ લખે ને તમે એકલા  
‘ભ’?! તો શું આ બધા ખોટા?”

“ના, સાચા-એય સાચા!”

“આય સાચું ને એય સાચું!! લો, કરો વાત! બેય સાચું કેવી રીતે હોય? દાદા, તમે  
દુધમાં ને દહીમાં બેયમાં પગ રાખો છો!!”

“જો દીકરા! દુધ કે દહીં એકકેયમાં પગ ન રખાય. બેય મોંમાં મુકવાની વસ્તુઓ છે.  
બગાડાય નહીં!”

“ને, ભાષા, મોંમાંની વસ્તુ નથી? એ બગાડાય?”

“પણ મોંને લાહુ અને કુલવરી બેય ભાવતાં હોય તો?”

“વાત આડે પાટે ચડાવવામાં ગામણાનું લોક ઉસ્તાદ-! કેમ દાદા? તમે ખોટા  
ઉચ્ચાર અને ખોટું લખાણ કરો પછી પાછા બચાવ કરો! તમે બસ ‘સૌરભ’નું પુંછું પક્કાયું  
એ જ ખરું!!”

મેં એને સંસ્કૃતનો શબ્દકોશ હાથવળો હોય તો આપવા કહ્યું. લાવી. બતાવ્યું.

“અરે, આમાં તો ‘ભ’ છે! તો, ‘વ’ કેમ થયો?”

“બોલનારને ભાવ્યો ને ફાય્યો-! ઠીક. તારા નામમાં ‘વ’ હતો?”

“ના રે ના!”

“જો, મુળ શબ્દ તો ‘વષ્ણી’.”

“હા, હોં! ‘બરખા’ તો તમે સુચરેલું.”

“બંગાળીમાં એમ બોલાય છે. ‘વ’ છે જ નહીં!”

“હેં! નથી?”

“જો બંગાળી શબ્દકોશ...”

“છે મારી પાસે. બંગાળી ‘સાહીત્ય સંસદ’ની બંગાળી અંગેજી તીક્ષનરી.”

“લાવ.... જો.... આ પાનું એક હજાર એકસો ને બાવીસમું. જો..”

“આમાં તો બે વાત જ લખી છે ! એક, કે આ બંગાળી કક્કાનો ઓગણત્રીસમે  
અક્ષર છે; અને બે, ‘વ’થી શરૂ થતા બધા શબ્દો પાન આઠસો ત્રેપન પર છે ! આમ કેમ?”

“કારણ કે ‘વ’ એ લોક બોલી શકતા જ નથી. જાણો છે ખરા કે ‘વષ્ણ’માં લખાય તો ‘વ’; પણ બોલાય તો ‘બ’ કે ‘ભ’.”

“બોલી કેમ ન શકે?”

“દરેક ભાષા બોલનાર અમુક જ ઉચ્ચારો કરી શકે છે. દાખલા તરીકે અંગ્રેજ બોલતાં આપણે અંગ્રેજો કે અમેરીકનો પ્રમાણે ન બોલી શકીએ. ને અંગ્રેજ આપણો ‘ત’ કે ‘દ’ કે એવા બીજા ઘણા ઉચ્ચાર-એકમો ન જ બોલી શકે.”

“એટલે, ઉચ્ચાર ભાષાએ-ભાષાએ જુદા. એ તો બરાબર. પણ એકની એક ભાષામાંય ઉચ્ચાર ફરે? એ કેવું? સંસ્કૃતમાં તો એવું નથી!”

“કોણે કહ્યું? વેદના વારાના સંસ્કૃતમાં ‘હરિ’, ‘મહિ’માંના આજના હુસ્ત્વ ‘ઈ’ તે દીર્ઘ હતા! કેટલાય જુદા હતા!”

“તો, સંસ્કૃતેય શું ફેરફાર થઈને આવેલી ભાષા હતી?”

“હાસ્તો! ભાષા બહતા નીર! નદી પર્વત પરથી નીકળે ને ઢાળ મળે ત્યાં વહે! તે વખતે પછી પર્વતે એના ઉદ્ગામ આગળ ઉભેલો માણસ કહે કે ‘નદી, નદી, પાછી આવ!’ તો એ પાછી આવી શકે ખરી? એ તો બેથ કાંઠાનાં જીવનને લીલું લીલું રાખતી વહે જ જાય. એમ ભાષા પણ.”

“નદીને તો વહેણનું તળ છે. ભાષાને એવું તળ હોય? કયું?”

“લોકની જીબ ને લોકનું મન. ઢાળ-સરળતા જ એનું બળ. એ જ એને વહેવડાવે.”

“પણ અમારાં બહેન ગુજરાતી શીખવે છે તે કહે છે કે સરળતાનું પુછું પકડનારા ભાષાને બગાડે છે! ન્હાનાલાલે અમથું કહ્યું હશે કે ‘નરી સરળતા કોણ પુજશે?’”

“કોણ નહીં પુછે તે કહું: પંડીતો. કોઈ ન સમજે એવું લખી શકો તો તમે ‘લેખક’! હું તો માનું છું કે સહજ બોલાતી બહુજન-સમજની ભાષા તે જ વધુ ઉપયોગી. બોલાતી ભાષાની અસર લખાતી પર પણ પડતી જ હોય છે.”

“બોલાતી ભાષા જબરી કે લખાતી?”

“બોલાતી ભાષા લખાતીને બદલી શકે.”

“કેવી રીતે? દાખલો આપો. દાદા, અધ્યરવાત ન કરો. અને હવે બધી ભાષાની વાત કરો છો તો અંગ્રેજીમાંથી દાખલા આપો!”

“જો દીકરી, હું તો ગામડામાં રહું છું. બહુ અંગ્રેજ તમારી જેમ અંગ્રેજ મીહીયમમાં ભણ્યો નથી.”

“પણ તમારા વખતમાં અંગ્રેજ સારું શીખવાતું.”

“એટલે તો દાખલો આપી શકું છું. આપણે આજેય ‘નારંગી’ શબ્દ બોલીએ છીએ ને? એને માટેનો અંગ્રેજ શબ્દ કયો?”

“ઓરે-જ.”

“‘રંગી’ અને ‘રે-જ’ મળતા આવે છે?”

“થોડાક. ‘ર’ કોમન છે. ‘ગ’ ને સ્થાને ‘જ’ છે.”

“મુળ સ્પેનીશ શબ્દ હતો / છે : ‘norange’.”

“ઓહ ! આપણા ‘ન’ નું મુળ મળ્યું.”

“પણ અંગેજમાં ‘ન’ કેવી રીતે ગયો તે વાત જાણવા જેવી છે. અંગેજમાં નામની આગળ ‘એ’ (A) કે ‘એન’ (An) આર્ટીકલ લગાડવાનો ચાલ રૂઢ થયેલો છે.”

“હા. એટલે ‘એન ઓરેન્જ’ થાય.”

“ના ! મુળમાં ‘એ-નોરેન્જ’ થાય ! પછી ‘એ-નોરેન્જ’ બોલનારે ‘એન-ઓરેન્જ’ માની લીધું ! ને ‘ન’ એમ ઉડી ગયો !”

“બીજા આવા શબ્દોથ હશે. છે. ઘણા. પણ ચચ્ચિને લંબાવવાનો અર્થ ખરો ?”

“દાદા, શબ્દનેય ઈતીહાસ હોય, ખરું ને ?”

“હોય જ. ને એનું અલગ શાસ્ત્ર પણ છે. પણ એનોય સાર છે : સરળતાનું મોટું અવલંબન.”

“પણ એક દાખલો બીજો આપો.”

“હ૱ક્કટરો - ખાસ કરીને જે અહંકાર બાંધવાળો સફેદ હાફ્કોટ જેવો ડગલો પહેરે છે-”

“અમેય પ્રયોગશાળામાં પહેરીએ છીએ-”

“-એને શું કહેવાય?”

“એપ્રન.”

“બરાબર : ... પણ મુળ શબ્દ છે ‘નપ્રન’ !”

“પેલા ‘ઓરેન્જ’ જેવું થયું હશે- ‘એ નેપ્રન’ નું ‘એન એપ્રન’ ગણાયું હશે ને પછી ‘એપ્રન’ જ ચલણી બન્યું હશે.”

“એકજેક્ટલી ! એમ જ. મુળ અર્થ પણ ક્યારેક બદલાય. ‘પેન’ (Pen) મુળમાં લેટીન Penna એટલે ‘પીંછુ’ ! ને મુળ લેટીન ‘Penicillias’ એટલે ‘બ્રશ’. એના અર્થ ફરી ગયા ને થયું ‘પેન’ એટલે ‘કલમ’ ને ‘પેન્સીલ’ એટલે ‘સીસાપેન’ !”

“આમ કેમ થયું?”

“સરળતા, સહજ પરીવર્તન, સહજ સમાધી !”

“પણ દાદા !” બરખાએ હસતાં હસતાં ટોળમાં પુછ્યું : “નહાનાલાલ ખોટા ? ‘નરી સરળતા કોણ પુજશે?’

“દીક્કુ ! એની સામે એક અંગેજ (ગીક) કુહેણ છે, વીચારજે ને તારાં બહેનને પણ કહેજે : ‘સીમ્પ્લીસીટી ઈજ ગેન્ઝોર.’”

સરળતા તો છે ભવ્યતા ! ગાંધી જેવી. સરળતાને સાધવી સહેલી નથી. શબ્દોને સરળ થતાં યુગો લાગ્યા છે. એ ‘સહજ સમાધ’ નું ફળ છે.

ને બરખા ગાતી ગાતી ચાલી ગઈ,

‘બરખા રીતુ બેરી હમા...રી !’

મેં સામે કદ્યું :

‘ઓ બરખા કે પહેલે બાદલ ! મેરા સંદેશા લે જાના !’

## --માધવ ગોર

'વેણુ', ૬-ઘોષા સોસાયટી,  
થલતેજ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૫૪

તા. ૧ ડિસેમ્બર ૨૦૦૫ના, 'નયામાર્ગ' પાક્ષિકમાં, 'ગુજરાતી ભાષાપરીષદ' દ્વારા દર બે  
માસે પ્રગટી 'ભાષાવીચાર' નામક પુત્રી-૧૭માંથી-પાન ૨૮. તા. ૧૨ ફેબ્રુઆરી  
૨૦૦૬ની 'સંદે મહેશીલ-૩૬' માટે 'ઉત્તમગાજી' અને 'વીજયા-કલાપી' ફેન્ટમાં  
પુનર્દેખન : [uttamgajjar@hotmail.com](mailto:uttamgajjar@hotmail.com)

-SURAT-